

Seat No. : \_\_\_\_\_

# AC-105

April-2016

B.Sc., Sem.-VI

CC-308 : Chemistry (Inorganic)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (a)  $d^2$ -રચના માટે પીજાન હોલ આકૃતિ દોરો તથા ટર્મ સંજ્ઞા તારવો. ઉદ્ભવતી ટર્મ સંજ્ઞાઓને કારણસહ ચઢતા ક્રમમાં ગોડવો. 7  
**અથવા**  
નીચે દર્શાવેલ પદ માટે ટર્મ સંજ્ઞાઓ મેળવો :  
(1)  $Ti^{+3}$  ( $Z = 22$ )  
(2) S ( $Z = 16$ )  
(3)  $Ni^{+2}$  ( $Z = 28$ )
- (b)  $d^2-d^8$  રચના માટે ઓર્ગલ આલેખ સમજાવો. 7  
**અથવા**  
 $[Cu(H_2O)_6]^{+2}$  નો શોષણ વર્ણપટ સમજાવો.
2. (a) હર્મિશિયન કારક એટલે શું ? સાબિત કરો કે હર્મિશિયન કારકના આયગન મૂલ્યો હુમેશા વાસ્તવિક હોય છે. 6  
**અથવા**  
નીચેના તરંગ વિધેયો માટે સામાન્યીકૃત અચળાંક મેળવો :  
(1)  $\psi = Ne^{im\phi}$       જ્યાં  $0 \leq \phi \leq 2\pi$   
(2)  $\psi = N \sin \frac{n\pi x}{a}$       જ્યાં  $0 \leq x \leq a$
- (b) ત્રિપરિમાળીય પેટીમાં રહેલા કણ માટે ડીજનરેસી સમજાવો. 8  
**અથવા**  
નીચેના કારકોની રચના કરો :  
(1) રેખીય વેગમાન કારક  
(2) હેમિલ્ટોનીયન કારક
3. (a) વેરીએશન પ્રમેય સમજાવી સાબિત કરો કે  $\bar{E} \geq E_0$ . 6  
**અથવા**  
એલાઈલ કેટાયન (Allylic cation) માટે હ્યુકેલનો પ્રમેય સમજાવો.  
(b) સંકરણ એટલે શું ? તેના પ્રકાર જણાવો. SP સંકર કક્ષકો માટે તરંગ વિધેય ઉપજાવો. 8  
**અથવા**  
ઈથીલીન અણુ માટે સાદો હ્યુકેલનો સિદ્ધાંત સમજાવો.

4. (a)  $\text{Ni}(\text{CO})_4$  અને  $\text{Fe}_3(\text{CO})_{12}$ ની સંરચના ચર્ચો.

7

અથવા

ધાતુ કાર્બોનીલના બંધારણના અભ્યાસમાં IR વર્ણપટની ઉપયોગીતા ચર્ચો.

- (b) કાર્બિ-ધાત્વીક સંયોજનોની વ્યાખ્યા આપો, તેમનું વર્ગીકરણ સમજાવો.

7

અથવા

ફેરોસીનનું બંધારણ સમજાવો.

5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

14

- (1)  $[\text{Mn}(\text{H}_2\text{O})_6]^{2+}$  સંકીર્ણ શાથી આછો ગુલાબી રંગ દર્શાવે છે ?
- (2) d-d વર્ણપટ શાથી અતિ દુર્બળ અને અસંમિતિય હોય છે ?
- (3) સ્પીન મલ્ટીપ્લિસીટીનો નિયમ લખો.
- (4) શૂન્ય બિંદુ શક્તિ એટલે શું ?
- (5) વ્યાખ્યા આપો : કોમ્પૂટ કારક
- (6) શ્રોડિંજર સમીકરણનું ટૂંકું સ્વરૂપ લખો.
- (7) કવોન્ટમ આંક 'J' શેના માટે જાહીતો છે ?
- (8)  $\text{SP}^3$  સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ ખૂણો આપો.
- (9) એલાઈલ કાર્બ-કેટાયનમાં  $\pi$ -ઇલેક્ટ્રોનની સંખ્યા લખો.
- (10) ચલપ્રમેયનો ઉપયોગ લખો.
- (11) ફોસ્ફેટ લખો.
- (12) પેન્ટાગોનલ બાયપીરામીડલ રચના ધરાવતા ધાતુ કાર્બોનીલ હાઈડ્રોઈડનું ઉદાહરણ આપો.
- (13) નાઈટ્રોસીલ NO સમૂહ લિગાન્ડ તરીકે ક્યારે વર્તે છે ?
- (14)  $\text{CO}_2(\text{CO})_8$  ધાતુ કાર્બોનિલમાં શ્રીજ અને અંતિમ CO સમૂહની સંખ્યા લખો.

**AC-105**

April-2016

**B.Sc., Sem.-VI****CC-308 : Chemistry (Inorganic)****Time : 3 Hours]****[Max. Marks : 70**

1. (a) Draw the pigeon hole diagram for  $d^2$  configuration and derive all the term symbols for it. Arrange all the term symbols in the increasing order of energy giving reason. 7

**OR**

Derive the term symbol for the following :

(1)  $Ti^{+3} (Z = 22)$

(2)  $S (Z = 16)$

(3)  $Ni^{+2} (Z = 28)$

- (b) Explain orgal diagram of  $d^2-d^8$  configuration. 7

**OR**Explain spectrum of  $[Cu(H_2O)_6]^{+2}$ .

2. (a) What is Hermitian operator ? Prove that eigen values of Hermitian operators are always real. 6

**OR**

Obtain Normalized constant for following wave function :

(1)  $\psi = Ne^{im\phi}$  where  $0 \leq \phi \leq 2\pi$

(2)  $\psi = N \sin \frac{n\pi x}{a}$  where  $0 \leq x \leq a$

- (b) Explain Degeneracy for particle in three dimensional box. 8

**OR**

Construct following operators.

(1) Linear momentum operator.

(2) Hamiltonian operator.

3. (a) Explain variation principle and prove that  $\bar{E} \geq E_o$ . 6

**OR**

Explain Huckel theory for allylic cation.

- (b) What is hybridization ? Give its types. Obtain the wave functions for SP hybrid orbitals. 8

**OR**

Explain the simple Huckel theory for ethylene molecule.

4. (a) Discuss the structures of  $\text{Ni}(\text{CO})_4$  and  $\text{Fe}_3(\text{CO})_{12}$ . 7

**OR**

Explain the application of IR Spectra in the study of structures of metal carbonyls.

- (b) What is organometallic compounds ? Explain the classification of OMC. 7

**OR**

Discuss the structure of Ferrocene.

5. Answer the following in brief. 14

- (1) Why the colour of  $[\text{Mn}(\text{H}_2\text{O})_6]^{2+}$  is light pink ?
  - (2) Why the d-d spectra is very weak and unsymmetrical ?
  - (3) Write spin multiplicity rule.
  - (4) What is zero point energy ?
  - (5) Define : Commute operator.
  - (6) Write short form of Schrodinger equation.
  - (7) The quantum number 'J' is known for \_\_\_\_\_.
  - (8) Give the bond angle between  $\text{SP}^3$  hybrid orbitals.
  - (9) Write no of  $\pi$ -electron in allylic carb cation.
  - (10) Write the use of variation theorem.
  - (11) Write the  $\phi$  equation.
  - (12) Give the example of pentagonal bipyramidal structure of metal carbonyl hybride.
  - (13) When the Nitrosil NO group behave as a ligand ?
  - (14) Write the no. of bridge and non bridge CO group in  $\text{CO}_2(\text{CO})_8$ .
-